

To BSE Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai- 400 001. BSE Scrip Code: 524202

Sub: Intimation under Regulation 47(3) of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015.

Pursuant to Regulation 47(3) read with Regulation 30 of the Securities and Exchange Board of India (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, Please find enclosed newspaper cutting of Public Notice published in the Newspapers viz. – Business Standard (in English) and Vadodara Samachar (in Gujarati), in compliance with the Ministry of Corporate Affairs Circular dated 05thMay, 2020 and 13thJanuary, intimating that the 30th Annual General Meeting (AGM) of our Company scheduled to be held on Thursday, 30th September, 2021 at 12:00 noon (IST) will be held through electronic mode (Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM").

Kindly take the same on record.

Thanking you,

For Lactose (India) Limited

RITESH KUMAR PANDEY PANDEY Date: 2021.09.04 14:21:20 +05'30'

Ritesh Pandey Company Secretary & Compliance Officer Mem No.- A45942 Date:04thSeptember, 2021 Place: Mumbai

G-02, Ground Floor, 'A' Wing, Navbharat Estate, Zakaria Bunder Road, Sewri (W), Mumbai - 400 015. India Tel.: 91-22-2411 7030 / 31 / 32 Fax: 91-22-24117034 E-mail: lactose@vsnl.com Website: www.lactoseindialimited.com Regd. Office: Survey No. 6, Village Poicha (Rania), Taluka Savli, District Vadodara, Gujarat - 391 780 India







IDFC FIRST BANK LIMITED Bank IDFC FIRST (erstwhile Capital First Limited) and amalgamated with IDFC Bank Limited) CIN : L65110TN2014PLC097792

CIN : LOSTIOTN2014/LC097/52 Registered Office : KRM Towers, 8th Floor, Harringtone Road, Chetpet, Chennai-600031. TEL : +91 44 4564 4000 | FAX : +91 44 4564 4022 AUTHORIZED OFFICER – Satyendra Maurya CONTACT NUMBER- 8306001848 AUTHORIZED OFFICER – Debjyoti Roy CONTACT NUMBER- 9874702021

PROPERTY FOR SALE UNDER PROVISIONS OF SARFAESI ACT, 2002 BY PRIVATE TREATY

Whereas the Authorised Officer of IDFC FIRST Bank Ltd has taken the Possession u/s 13(4) of the Securitisation& Reconstruction of Financial Assets and Enforcement of Security interest Act, 2002 (The SARFAESI Act, 2002) of the property being Immovable Property, Premises of Flat No. c/302. admeasuring 622.00 sg.fts, i.e 57.80 sg. mtrs, Building No. C, 3rd Floor, Parasmani Co. Housing Society Ltd, Developed upon land situated in State - Gujarat, District- Surat, Sub- District, & Taluka: Choraysi, Moje Village Adjan, bearing Revenue No. 298/1/B, T.P Scheme No. 13, Final Plot No. 277 Paikee. ("the Secured Asset") with respect to Loan Account No.9329318&9332600of 1.Anil Genubhai Pawar & 2.Sangita Anilbhai Pawar (Borrowers). The Authorised Officer has received an expression of interest from a prospective purchaser towards purchase of the above mentioned Secured Asset under the SARFAESI Act. Now, the Authorised Officer is hereby giving the Notice to Sale of the aforesaid property by Private Treaty in terms of rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules 2002. The Sale will be on "AS IS WHERE IS BASIS and AS IS WHAT IS BASIS"

The Date of Sale under Private Treaty is fixed for 21.09.2021 and the Reserve Price fixed for the sale is Rs.6,00,000 /- (Rupees Six Lakhs Only).

The Borrower and Co Borrower are hereby notified to pay the sum as mentioned in the demand notice i.e (Rs. 10.98.864.37/- Rupees Ten Lakhs Ninety Eight Thousand Eight Hundred Sixty Four and Paise Thirty Seven Only) along with interest and ancillary expenses before 21.09.2021, failing which the property will be sold by Private Treaty.

| Date: 03.09.2021 | Authorised Officer | |
|------------------|-------------------------|--|
| Place: Surat | IDFC FIRST BANK LIMITED | |

LACTOSE LACTOSE (INDIA) LIMITED CIN: L15201GJ1991PLC015186

Registered Office: Survey No 6, Village Poicha (Rania), Taluka Savli, Vadodara, Gujarat 391780. Corporate Office: G-2, A Wing Navbharat Estate, Zakaria Bunder Road,

Sewri (W), Mumbai 400015. Contact : 022-24117031 Fax: 022-24117034 Email: III@lactoseindialimited.com; Website: www.lactoseindialimited.com

NOTICE OF THE 30[™] ANNUAL GENERAL MEETING This is to inform that in view of the outbreak of the Covid-19 pandemic, the 30th Annual General Meeting ("AGM") of the Company will be held through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") on Thursday, 30th September, 2021 at 12.00 noon IST in compliance with all the applicable provision of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, (SEBI Listing Regulations) and MCA Circula dated 13" January, 2021 read with circulars 08" April, 2020, 13" April, 2020, 05" May, 2020, 28" September, 2020 and 31" December, 2020 (MCA Circulars) to transact the business set out in the Notice to the AGM. The deemed venue for the 30" AGM will be the registered office of the company.

The Notice for convening the AGM along with the Annual Report for the FY 2020-2021 ("Annual Report") will be sent only through electronic mode to those Members whose email addresses are registered with the Depository Participant ("DPs")/Company/Registrar and Transfer Agent viz Big Share Services Private Limited ("RTA") in accordance with the MCA Circular and SEBI Regulations.

Members holding shares in physical mode, who have not registered / updated their email addresses or mobile number with the Company, are requested to register a update the same by clicking on https://bigshareonline.com// InvestorRegistration.aspx#AdvdTrack# and members who have shares in dematerialized form and not yet registered their e-mail addresses are requested to register the same with their DPs.

Members can attend and participate in the AGM only through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM"). The procedure or instructions for

BARODA EXTRUSION LTD Regd. Office: Survey No 65-66, Village Garadia, Jarod-Samalaya Road, Taluka: Savli, Dist. Vadodara CIN NO. L27109GJ1991PLC016200 • Web. www.barodaextrusion.com • Mail. works@barodaextrusion.com • Tel. 0265-3207206

NOTICE FOR E-VOTING & BOOK CLOSURE

Notice hereby given that the 30" Annual General Meeting (AGM) of the members of the Company will be held on 29th September, 2021 at 11:00 a.m. at Survey No. 65-66, Village Garadiya, Jarod -Samalaya Road, Taluka Savli, Dist. Vadodara, Gujarat to transact the Ordinary and Special Businesses set out in the Notice of the AGM

Notice is also given under Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules 2014 that the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Thursday, 23rd September, 2021 to Wednesday, 29th September, 2021 (Both days inclusive) for the purpose of the AGM.

Report for the year 2020-21. The communication relating to remote e-voting,

at 09.00 a.m

(5.00 p.m.)

. Cut-off date: (date - Seven days before AGM) 22nd September, 2021

5. A member may participate in the General Meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting; and

Notice of the Annual General Meeting has been displayed on the web site of the Company www.barodaextrusion.com and on website of e-voting platform provided by National Securities Depository Limited i.e. www.evoting.nsdl.com. In case you have any queries or issues regarding e-voting, write an email works @barodaextrusion.com or contact Ms. Vaishali Sharma

Managing Director

THE HI-TECH GEARS LIMITED 1 CIN: L29130HR1986PLC081555

and Password for casting their votes.

Regd. Off. : Plot No. 24 - 26, IMT Manesar, Sector-7, Gurugram-122050, Haryana Corp. Off. : 14th Floor, Millennium Plaza, Tower-B, Sushant Lok-I, Sector-27, ugram-122002, Haryana. Tel.: + 91(124) 4715100 Fax: + 91(124) 2806085 Website: www.thehitechgears.com E-mail: secretarial@thehitechgears.com

NOTICE OF 35TH ANNUAL GENERAL MEETING (A) Annual General Meeting ("AGM") & Book Closure:

Notice is hereby given that 35th Annual General Meeting ("AGM") of the members of the Company will be held on Wednesday, September 29, 2021 at 05:00 P.M. at the registered office of the Company at - Plot No. 24, 25 & 26, Sector-7, IMT Manesar, Gurugram-122050, Haryana along with the facility to attend the AGM through Video Conferencing ("VC") / Other Audio Visual means ("OAVM") in view of the continuing COVID-19 pandemic and in compliance with applicable provisions of the Companies Act. 2013, rules framed thereunder, SEBI (LODR) Regulations, 2015, read with circulars issued by MCA and SEBI in this regard, to transact the business as set out in the Notice of the AGM. The facility for voting through ballot paper/e-voting shall be made available at the AGM and the Members attending the neeting who have not cast their vote by remote e-voting shall be able to exercise their right at the meeting through ballot paper/e-voting. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it subsequently. Members can opt for only one mode of voting, i.e., either by ballot paper or remote e-voting or through E-Voting (where the members attending the meeting though VC or OAVM facility). In case Members cast their votes through any of the mode, voting done by remote e-voting shall prevail and votes cast through ballot paper or e-voting shall be treated as invalid. The Notice of AGM and Annual Report have been sent in electronic form to those members whose e-mail addresses are registered with the Company/ Registrar and Share Transfer Agent ('RTA')/ Depository Participant. Notice is also given pursuant to Section 91 of the Companies Act, 2013 ('the Act') read with Rule 10 of Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI (LODR)') that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Thursday, September 23, 2021 to Wednesday, September 29, 2021 (both days inclusive) for the purpose of AGM and payment of Final Dividend for the financial y 2020-21, if approved by the shareholders.



WELTERMAN INTERNATIONAL LIMITED

Regd. Office & Factory: Plot No. 1135, At & Post: Lamdapura, Lamdapura Road, Tal. Savii, District Vadodara - 391 775.

CIN: L51100GJ1992PLC017613

Nebsite: www.welterman.com

Ph.: (0265) 2310250/ (02667) 262201

E-mail: companysecretary.wil@gmail.com

NOTICE OF THE 29[™] ANNUAL GENERAL MEETING,

BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that 29th Annual General Meeting (29th AGM) of the Members

of Welterman International Limited ('the Company') will be held on Tuesday,

September 28, 2021 at 04:00 P.M. (IST) through Video Conferencing (VC) / Other

Audio-Visual Means (OAVM) in compliance with General Circular No. 14/2020

dated April 08, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May, 05 2020

and 02/2021 dated January 13, 2021 and other applicable circulars, if any, issued

by the Ministry of Corporate Affairs (MCA) and Circular No.

SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 followed by Circular

No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021 issued by SEBI-Securities and Exchange Board of India. Hence, the 29th AGM of the Company is

being held through VC/OAVM to transact the business as set forth in the Notice of

the 29" AGM dated August 13, 2021. Members participating through the VC/ OAVM

facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the

In compliance with the Circulars, electronic copies of the Notice of the 29th AGM and

Annual Report 2020-21 have been sent to all the members whose email IDs are

registered with the Company/Depository Participant(s). These documents are also

available on the website of the Company at www.welterman.com, stock exchange

website i.e. BSE Limited (BSE) at www.bseindia.com and also on the CDSL's

website at www.evotingindia.com. The dispatch of Notice of the AGM through

Pursuant to the provisions of section 91 of the Companies Act, 2013, The Register

of Members and Share Transfer Books of the Company will remain closed for the

purpose of Annual General Meeting from 22" September, 2021 to 28" September,

In terms of Section 108 of the Companies Act, 2013 read with amended Rule 20 of

the Companies (Management and Administration) Amendment Rules, 2015 and

Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements)

Regulations, 2015, as amended from time to time, Members holding equity shares

either in physical form or dematerialization form, as on the cut-off-date (Record

date) Tuesday, 21" September, 2021, may cast their vote electronically on the

business as set forth in the Notice of the 29th AGM through the e-voting service

provided by the CDSL. The voting rights of the members shall be in proportion to the

equity shares held by them in the paid up equity share capital of the Company as on

The remote e-voting period commences on Saturday, 25th September, 2021 at

09.00 a.m. and will end on Monday, 27th September, 2021 at 5:00 p.m. During this

period, Members may cast their vote electronically. The remote e-voting module

shall be disabled by CDSL thereafter. Those Members, who shall be present in the

AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions

through remote e-voting and are otherwise not barred from doing so, shall be

Any person, who acquire share of the Company and become a Member after the

Notice has been sent electronically by the Company and holds shares as on cut-off

date; may obtain the login id and password by sending a request to

helpdesk.evoting@cdslindia.com. However, if any shareholder is already

registered with CDSL for remote e-voting, then they can use their existing User ID

All grievances connected with the facility for voting by electronic means may be

addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL,) Central Depository Services

(India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N

M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to

For Welterman International Limited

Sd/-

A-60909

Nikita Christian

Company Secretary

emails has been completed on 3rd September, 2021.

sday, 21* September, 2021 (cut-off date).

eligible to vote through e-voting system during the AGM.

registered their e-mail addresses is provided in the Notice of AGM.

Companies Act, 2013.

2021 (both days inclusive)

RUSHIL DECOR LIMITED Regd. Office: S. No.125, Near Kalyanpura Patia, Vill. Itla, Gan Mansa Road, Tal. Kalol, Dist. Gandhinagar -382845, Gujarat, Corporate Office: Rushil House, Near Weelkanth Green Bungalow, Off. Sindhu Bhavan Road, Shilai, Ahmedabad-380058, Gujarat, India. Ph::+91-079-61400400 Fax :+91-079-61400401 E-mail : ipo@rushil.com Website : www.rushil.com CIN : L25209GJ1993PLC019532

WENTY SEVENTH ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE NOTICE OF TWEN

NOTICE is hereby given that the 27th Annual General Meeting (AGM) of the Shareholders of he "Rushil Décor Limited" ("Company") will be held on Monday, 27th September, 2021 a 11:15 A.M. (IST) through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") nce of physical quorum to transact the business as set out in the Notice of th without pres AGM.

The Notice convening AGM along with Annual Report of the Company has been sent throug ectronic mode on September 03, 2021 to all the Shareholders of the Company whose emai ids were registered with Company/ Depository Participant(s). The notice of 27th AGM and nnual Report 2020-21 is available on the website of Company at www.rushil.com and ebsite of stock exchanges (where the company is listed) at www.bseindia.com and ww.nseindia.com and on the website of NSDL (agency providing e-voting facility) a ww.nsdl.co.in

Pursuant to the provisions of Section 91 of the Companies Act. 2013, the Register of Member and the Share Transfer Books of the Company will remain closed from Tuesday 21s September, 2021 to Monday, 27th September, 2021 (both days inclusive) for payment of fina ividend and Annual General Meeting. The final dividend as recommended by the Board, i clared at the AGM, will be paid to those Shareholders whose name appears as at the close of business hours on Monday, 20th September, 2021, based on beneficial ownership detail ceived from Central Depository Services (India) Limited, National Securities Depo Limited and Register of Members maintained by Registrar and Share Transfer Agent.

Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Compan Management and Administration) Rules, 2014 as amended, the Company is providing to its ders a facility to exercise their rights to vote on a resolution proposed to be passed a ne AGM of the Company using an electronic voting system from a place other than venue of the AGM ('remote e-voting').

The remote e-voting facility shall co ence on Thursday, 23rd September, 2021 from

9.30 A.M. (IST) and ends on Sunday, the 26th September, 2021 at 5:00 P.M. (IST). The remot -voting shall not be allowed beyond the aforesaid date and time. Shareholders of th Company holding shares either in physical form or in Demat form, as on the cut-off date i.e fonday, 20th September, 2021 shall only be entitled to avail the facility of remote e-voting a ell as voting during the AGM (e-voting). Shareholders who have casted their vote by re -voting may attend the AGM but shall not be entitled to cast their vote at AGM.

lembers are provided with a facility to attend the AGM through electronic platform provided t National Securities Depository Limited (NSDL). Members may access the platform to atten the AGM through VC at https://www.evoting.nsdl.com by using the remote e-voting crede The link for VC/OAVM will be available in shareholders/ members login where the EVEN of Company will be displayed.

etailed procedure of remote e-voting /e-voting and attending the AGM through VC/OAVM ha een provided in the Notice of AGM. Any person who becomes the Shareholder of the Company after sending the Notice of AGM and holding shares as of the Cut-off date may follo the procedure as provided in the Notice of the AGM.

In case of any query or grievance connected with facility for voting by electronic mean embers may contact to Mr. Hasmukh K. Modi, Company Secretary of the Company, Contac umber : +91-79-61400400, Email Id: Ipo@rushil.com Address: Rushil House, Nea elkanth Green Bungalow, Off. Sindhu Bhavan Road, Shilaj, Ahmedabad-380058, Gujara ndia



| यूनियन नैक () Union Bank | ASHRAM ROAD BRANCH : C U SHAH CHAMBERS, NEAR GUJARAT VIDHYAPITH, AHMEDABAD – 380 014. Phone: 079-27542613 Email: ashramroad@unionbankofindia.com |
|--------------------------|---|
| POSSESS | ION NOTICE [Rule - 8(1)] |

Whereas, The undersigned being the authorised officer of the Union Bank of India, Ashram Road Branch, Ahmedabad under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 22nd April, 2021 calling upon the borrower M/s. Mukta Industries Pvt Ltd to repay the amount mentioned in the notice being Rs.31,77,53,324.37/- (in words Thirty One Crores Seventy Seven Lakhs Fifty Three Thousand Three Hundred Twenty Four and Thirty Seven Paise Only) within 60 days from the date of receipt of the said notice.

The borrower as well as guarantors having failed to repay the total amount, notice is hereby possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the said rules on this 1st day

of september of the year 2021. Borrower/Guarantor's attention is invited to provisions of sub-section (8) of section 13 of the said Act, in respect of time available to redeem the secured assets

The borrower/guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the properties will be subject to the charge of the Union Bank of India, Ashram Road Branch, Ahmedabad for the amounts of Rs. 31,77,53,324.37/- (in words Thirty One Crores Seventy Seven Lakhs Fifty Three usand Three Hundred Twenty Four and Thirty Seven Paise Only) as on 31-03-2021 and further interest and expense thereon

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

1. ALL THAT PIECE & PARCEL of Immovable property bearing Unit No.801 admeasuring about 90.30 Sq.Mtrs equilent to 108 Sq.Yds in "SARAP" Scheme of Surta Members Asociation standing/constructed thereon together with undivided share in land bearing Asociation standing construction instruction of the intervention o Khanpur, Taluka: Ahmedabad City, within the Registration Sub-District Ahmedabad-3 (Memnagar). Property held in the name of Shri.Hemendra Babulal Shah. Bounded: On the East by : Open Land, On the West by : Unit No.804, On the North by: Passage, On the South by Boad

The Company has completed to mail of the Notice of AGM and the Annual inter-alia, containing user ID and password has been dispatched to the members

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules 2014, as amended by the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the Listing Regulations, remote e-voting facility has been made available to the members to exercise their right to vote. The Company has engaged the services of NSDL to provide remote e-voting facility. The details of the remote e-voting are as under

1. Date and time of commencement of remote E-voting: 26th September, 2021

2. Date and time of end of remote E-voting: 28th September, 2021 at 5.00 p.m. 3. Remote e-voting shall not be allowed beyond this 28th September, 2021

6. A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as

voting in the General Meeting

tel. +91 9016203113 Email Id. accounts@barodaextrusion.com.

Place: Vadodara

Sd/-Parasmal Kanugo Date : 4" September, 2021



helpdesk.evoting@cdslindia.com. or call on 022-23058542/43. Place: Vadodara Date: 03.09.2021

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again. Members are requested to participate on first come first served basis, as participation through VC/OAVM is restricted up to 1000 members only. The manner of remote e-voting and voting at the AGM by members holding shares in dematerialized mode, physical mode and for and for members who have not

joining the AGM through VC/OAVM are stated in the notice.

The detailed procedure or instructions for casting votes through remote e-voting or e-voting during AGM for all Members (including the Members holding shares in physical form/ whose e-mail addresses are not registered with DPs/Company/RTA) are stated in the Notice.

This advertisement shall also be available on Company's website at www.lactoseindialimited.com and also on Stock Exchange's website at www.bseindia.com

By Order of Board of Directors For Lactose (India) Limited Sd/-**Atul Mahashwari**

Managing Director

Date : 03rd September, 2021 Place : Mumbai



Bardoli BRANCH : Laxmi House, M.G.Road, Bardoli-394601, Surat District, Gujarat. Mob: 9925451348, 02622-226679

Auction Sale Notice [Rule 8(6) And 9(1) of Security Interest(Enforcement) Rules 2002]

Auction Sale Notice for sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement Rules, 2002 Notice is hereby given to the public in general and in particular to the Borrower(s), mortgagor(s) and Guarantor(s) that the below described immovable property mortgaged to the Secured Creditor, the constructive possession of which has been taken by the Authorised Officer of Tamilnac Mercantile Bank Limited., Bardoli Branch, (Secured Creditor), will be sold on "As is where is". "As is what is", and "Whatever there is" on 18.10.2021, for the recovery of a sum of Rs.9,90,483.77 (Rupees Nine Lakh Ninety Thousand Four Hundred Eighty Three and Seventy Seven Paise only) due to Tamilnac Mercantile Bank Limited., Bardoli Branch (Secured Creditor) from M/s. Maharaja Enterprises (Proprietor: Gangasinh Khimsinh Rajput). The Reserve Price will be Rs.6,84,000/- and the earnest money deposit will be Rs.68400/-Sale Notice Addressed to:

(www.tmb.in)

Date: 03.09.2021

Place: Bardoli

M/s. Maharaja EnterpisesProp: Mrs. Gangasinh Khimsinh Rajput No.114, Sal Vandana Apartment, Third Floor, Gopal Nagar, Barben Gam,

Mr.Gangasinh Khimsinh Rajput

No.114. Sai Vandana Apartment, Third Floor, Gopal nagar, barben Gam, Bardoli-394601 Proprietor /Mortgagor

Description of Immovable Property

On equitable mortgage of Freehold undivided propertionate share in land and flat to the extent of 570 sq.ft. ie. 52.97 sq.mtrs at flat no.114, Third Floor, Sai Vandana, Block No.22 Paiki, Plot No.196,197,198,199, Gopal Nagar, baben Bardoli, Dist. Surat. standing in the name of Mr. Gangasinh Khimsinh Rajput Boundaries: North: 25 ft Internal Road, South: Flat No.11, East: 10 ft Gadavat .West: Flat No.112/A

| Place of Auction | Tamilnad Mercantile Bank Ltd, Bardoli Branch, Laxmi House, M.G.Road, bardoli-394601, Surat District, Gujarat Phone- 02622-226679 Mobile No.9925451348, 9150038035 |
|---------------------------------------|--|
| Date and Time of Auction Sale | 18.10.2021 at 12.00 PM |
| Reserve Price | Rs.6,84,000/- (Rupees Six Lakh Eight Four Thousand only |
| property as Earn drawn in favour o | ders should pay Ten Percent (10%) of the reserve price of the nest Money Deposit (EMD) by means of a "Demand Draft" of "Tamilnad Mercantile Bank Ltd" payable at Bardoli Branch 0.2021 within 11.30 A.M. For detailed terms and conditions of |

the sale, please refer to the link provided in secured creditors website

Authorised Officer

Ahmedabad Region

(For Bardoli Branch)

Tamilnad Mercantile Bank Limit

Meeting ("AGM") of the Members of Yuvraaj Hygiene Products Limited will t held on Thursday, the 30th day of September, 2021 at 12.00 Noon (IST) through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM) to transact the business as set out in the Notice of 26th AGM which will be e-mailed separately the members in due course.

YUVRAAJ HYGIENE PRODUCTS LIMITED

CIN: L74999MH1995PLC220253

Regd. Off.: Plot No A-650, 1* Floor, TTC Industrial Estate. MIDC. Pawane

Village, Mahape, Navi Mumbai - 400705

Tel: 022 2778 4491/92/93/94 | E-mail: yhpl@hic.in | Website: www.hic.in

Notice to Member - Information regarding 26th Annual General Meeting

to be held through Video Conference or Other Audio Visual Means

The Members are hereby informed that the 26th (Twenty Sixth) Annual Genera

Pursuant to the General Circular numbers 14/2020 dated 8th April, 2020, 17 2020 dated 13th April, 2020, 20/2020 dated 5th May, 2020 and 02/2021 date 13th January, 2021, issued by the Ministry of Corporate Affairs ("MCA") and Circula number SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 and SEBI/HO/ CFD/ CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021 issued by the Securities and Exchange Board of India ("SEBI") (hereinafter collectively referred to as "the Circulars"), companies are allowed to hold AGM through VC/OAVM, without the physical presence of members at a common venue. In compliance with the aforesaid Circulars, Companies Act, 2013 ("the Act") and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), the AGM of the Company will be held through VC/OAVM.

Notice convening the AGM and the Annual Report for the financial year ende 31st March, 2021 will be sent electronically to those Members whose e-ma address(es) are registered with the Company/Depository Participants(s)/Registral and Share Transfer Agent. The copy of the Notice will also be made available o he website of the Company viz., www.hic.in and on the website of the Stock Exchange where the equity shares of the Company are listed viz. BSE Limited a www.bseindia.com and on the website of Central Depository Services (India) imited ("CDSL") www.evotingindia.com.

In line with the Circulars issued by MCA and SEBI, Members are advised to updat their Email Ids in order to receive electronic copies of Annual Report/logi credentials, in the manner mentioned below, since no physical copies of Annu report will be dispatched to any member:

Members holding shares in physical mode and have not updated their ema addresses with the Company/Depository Participant(s)/Registrar and Share Transfer Agent ("RTA") are requested to update their email addresses by writing to Company's email id at yhpl@hic.in or CiL Securities Limited (RTA) email id at rta@cilsecurities.com with the subject line "Request to update email id". Member are requested to submit request letter mentioning the Folio No. and Name of Member along with the scanned copy of the Share Certificate (front and back) PAN (self - attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card).

Members holding shares in dematerialized mode are requested to register/updat their email addresses with the Depository Participant(s) or by email to the Company's email id or RTA's email id yhpl@hic.in / rta@cilsecurities.com Members are requested to submit their Demat account details (CDSL-16 digi beneficiary ID or NSDL-16 digit DPID + CLID), name, client master or copy of Consolidated Account statement. PAN (self -attested scanned copy of PAN card) AADHAR (self- attested scanned copy of Aadhar Card).

The Company and RTA shall co-ordinate with CDSL and provide login credential to the above mentioned shareholders, subject to the receipt of the required documents and information from the members.

VOTING THROUGH ELECTRONIC MODE (E-VOTING):

The Company has entered into agreement with CDSL, authorized e-voting agency for facilitating voting through electronic means ("remote e-voting") to enable th members to exercise their right to vote on the resolution proposed to be passed at the AGM as well as for the members who are present at the AGM through VC OAVM facility and wish to cast their vote during the AGM, through e-voting system ("e-voting")

The manner of 'remote e-voting' and 'e-voting' during the AGM, for member holding shares in physical mode, dematerialized mode and for members wh have not registered their e-mail addresses will be provided in details in the Notic of the AGM

In case you have any queries or issues regarding e-voting/remote e-voting, you may contact Mr. Rakesh Dalvi, Manager (CDSL) helpdesk.evoting@cdslindia.com or call at 022-23058542/43.

For Yuvraai Hygiene Products Limite

| | Sd/- |
|----------------|-------------------|
| | Vishal Kampani |
| e: Navi Mumbai | Managing Director |
| : 02/09/2021 | DIN: 03335717 |
| . 02/03/2021 | Din. |

(B) Remote E-voting:

Members of the Company be and are hereby informed that pursuant to Section 108 of the Act read with Rule 20 of Companies (Management and Administration Rules), 2014 and Regulation 44 of the SEBI (LODR) Regulations, 2015, the Company has offered Remote e-voting facility for its members to cast their vote electronically on all the resolutions set forth in the Notice from a place other than venue of AGM through the latform of National Securities Depository Limited (NSDL). The details pursuant to the ovisions of the Act and the said Rules are given hereund

- (a) Date and time of Commencement of remote e-voting: Sunday, September 26 2021 at 09:00 A.M.(IST)
- Date and time of end of remote e-voting: Tuesday, September 28, 2021 at 05:00 P.M.(IST). The e-voting module shall also be disabled for voting (b) thereafter
- (c) Cut-off date: Wednesday, September 22, 2021.
- Notice of AGM inter alia containing the procedures of E-voting, Proxy Form and Attendance Slips are available on the website of the Company at www.thehitechgears.com (d)
- Any person who have acquired shares after the dispatch of the Notice of AGM and before the cut-off date may approach the RTA or Company for issuance of the User ID and Password for exercising their right to vote by electronic
- (f) At the AGM, facility for voting through ballot paper/e-voting shall be made available and only the members as on the cut-off date" i.e. September 22, 2021 who have not cast their vote by remote e-voting shall be entitled to exercise their right to vote at the AGM through ballot paper/e-voting.
- A member may participate in the AGM even after exercising his right to vot through remote e-voting but shall not be allowed to vote again at the AGM.
- A person whose name is recorded in the Register of Members/ Beneficial owners as on the cut-off date shall only be entitled to avail facility of remote e-voting or voting in the AGM.

(C) E-Voting at the AGM

The facility for e-voting at AGM shall also be made available on the day of AGM i.e. on September 29, 2021. Members may access the same at <u>https://www.evoting.nsdl.com</u> under shareholders/members login by using the remote e-voting credentials. The members who have not cast their votes through remote e-voting can cast their vote a AGM.

The Company has appointed Mr. Nirbhay Kumar, proprietor of M/s Nirbhay Kumar 8 Associates, Practicing Company Secretary as Scrutinizer to scrutinize the voting process in a fair and transparent manner. For queries relating to e-voting, members may refer FAQs and e-voting user manual for members available in download section at www.evoting.nsdl.com or call on toll free no.: 1800-1020-990 or send a request at voting@nsdl.co.in

All correspondence related to e-voting may also be written to Mr. Naveen Jain, Company Secretary, at aforesaid address or email to secretarial@thehitechogears.com

(D) Final Dividend:

If final dividend on shares is approved at the AGM, payment of such dividend will be made to those members whose names appear in the Register of Members as per book closure mentioned above in terms of Section 91 of the Act, Regulation 42 of SEBI (LODR) Regulations, 2015 and other applicable provisions.

The aforesaid Notice of 35th AGM and Annual Report for the Financial Year 2020-21 ire also available on the website of the Company i.e. at www.thehitechgears.com For The Hi-Tech Gears Limited

| Sd/- |
|-------------------|
| Naveen Jain |
| Company Secretary |
| |

- ALL THAT PIECE & PARCEL of Immovable property bearing Unit No.802 admeasuring about 90.30 Sq.Mtrs equilent to 108 Sq.Yds in "SARAP" Scheme of Surta Members Asociation standing/constructed therein together with undivided share in land bearing Sub-Plot No.4-B & 5 of Final Plot No.148 of Town Planning Scheme No.3(allotted in lieu of old Revenue Survey No.758 & 759), situated, lying & being at Mouje: Shekhpur-Khanpur, Taluka: Ahmedabad City, within the Registration Sub-District Ahmedabad-3 (Memnagar). Property held in the name of Shri.Hemendra Babulal Shah. Bounded: On the East by : Open Land, On the West by : Unit No.803, On the North by : Unit No.801, On the South by : Road.
- ALL THAT FIECE & PARCEL of Immovable property bearing Unit No.803 admeasuring about 71.13 Sq. Mtrs on the 8th Floor in Surta Members Association, which is known as ated, lying & being on the land bearing Sub-Plot No.4-B & 5 of Final Plot "SARAP" situ No.148 of Town Planning Scheme No.3 within the sim Mouje: Shekhpur-Khanpur, Taluka: Amedabad City, within the Registration Sub-District Amedabad (Memnagar). Property held in the name of M/s.Prakash Steel Corporation. Bounded: On the East by : Passage & than Office No.802, On the West by: Marginal Open Space, On the North by Common Wall with Office No. 804. On the South by Marginal open Space
- ALL THAT PIECE & PARCEL of Immovable property bearing Plot No. A-31 having plot area admeasuring about 528 Sq.Yds equivalent to 441.47 Sq.Mtrs togeth undivided proportionate share admeasuring about 132 Sq.Yds equilent to 110.37 Sq.Mtrs in Internal Roads, Common Plots and other Common areas of "ARYAMAN" scheme aggregating to 660 Sq.Yds equivalent to 551.84 Sq.Mtrs sitiated on the land bearing Final Plot No.1, 2, 3, & 4 paiki of Draft Town Planning Scheme No.53 & 217 (allotted in lieu of Block No.466, 469, 470, 471, 473, 474, 475, 479 paiki, 362, 363 paik/1, 360, 1524, 1525, 482, & 742) situated, lying & being at Mouje: Shilaj, Taluka: Dascrol, within the Registration Sub-District & District Ahmedabad-3 (Memnagar). Property held in the name of Shri.Jitendra Babulal Shah. **Bounded:** On the East by : Plot A - 30 & Internal Road, On the West by : Land of Final Plot No.75, On the North by : Plot No. A-27, On the South by : Plot No. A-32.
- ALL THAT PIECE & PARCEL of Immovable property bearing Plot No. C-54 having plot Area admeasuring about 653 Sq.Yds situated in "Dhanshree Co-Operative Housing Society Limited standing/constructed on land bearing Block No.237(Old Revenue Survey No.334) situated, lying & being at Mouje: Chekhla, Taluka: Sanand, within the Registration Sub-District Sanand & District Ahmedabad. Property held in the name of Shri.Hemendra Babulal Shah. **Bounded:** On the East by : Road, On the West by : Plot No.C-55, On the North by : Road and thereafter Plot No.C-63, On the South by : Plot No.
- ALL THAT PIECE & PARCEL of Immovable property bearing Plot No. C-55 having plot area admeasuring about 853 Sq.Yds situated in "Dhanshree Co-Operative Housing Society Limited standing/constructed on land bearing Block No.237(Old Revenue Survey No.334) situated, lying & being at Mouje: Chekhla, Taluka: Sanand, within the Registration Sub-District Sanand & District Ahmedabad. Property held in the name of Shri.Naresh Babulal Shah. Bounded: On the East by : Plot No.C-54, On the West by : Plot No.C-56, On the North by : Road and thereafter Plot No.C-62, On the South by : Plot No. C-32
- ALL THAT PIECE & PARCEL of Immovable property bearing Plot No. C-56 having plot area admeasuring about 853 Sq.Yds situated in Dhanshree Co-Operative Housing Society Limited standing/constructed on land bearing Block No.237(Old Revenue Survey No.334) situated, lying & being at Mouje: Chekhla, Taluka: Sanand, within the Registration Sub-District Sanand & District Ahmedabad. Property held in the name of Shri.Pradeepbhai Babulal Shah. Bounded: On the East by: Plot No.C-55, On the West by Plot No.C-57, On the North by Road and thereafter Plot No.C-61, On the South by Plot No. C-31
- ALL THAT PIECE & PARCEL of Immovable property bearing Plot No. C-60 having plot area admeasuring about 853 Sq.Yds situated in "Dhanshree Co-Operative Housing Society Limited standing/constructed on land bearing Block No.237(Old Revenue Survey No.334) situated, lying & being at Mouje: Chekhla, Taluka: Sanand, within the Registration Sub-District Sanand & District Ahmedabad. Property held in the name of Shri.Prakash Babulal Shah. Bounded: On the East by : Plot No.C-61, On the West by : Plot No.C-59, On the North by : Margin Land, On the South by : Road and thereafter Plo
- ALL THAT PIECE & PARCEL of Immovable property bearing Plot No. C-61 having plot area admeasuring about 853 Sq.Yds situated in "Dhanshree Co-Operative Housing Society Limited standing/constructed on land bearing Block No.237(bl Revenue Survey No.334) situated, lying & being at Mouje: Chekhla, Taluka: Sanand, within the Registration Sub-District Sanand & District Ahmedabad. Property held in the name of Shri.Pankajbhai Babulal Shah. Bounded: On the East by : Plot No.C-62, On the West by : Plot No.C-60, On the North by : Margin Land, On the South by : Road and thereafter Plot No. C-56.

| Date: 01/09/2021 | Authorised Officer |
|------------------|---------------------|
| Place: Ahmedabad | Union Bank of India |

પોષણક્ષમ ભાવ માટે ખેડૂતો ૮ સપ્ટેમ્બરે દેશભરમાં ધરણા કરશે

(પ્રતિનિધિ) અમદાવાદ, તા. ૩ ભારતીય કિસાન સંઘની પડતર કિંમતના આધાર પર પોષણક્ષમ ભાવની માગણીનો છેલા ઘણા સમયથી ઉકેલ નહી આવતા ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી ૮ સપ્ટેમ્બરના રોજ

દેશભરમાં પ૨૫થી વધુ જિલ્લાઓમાં કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા એક જ દિવસે કલેક્ટર કચેરી સામે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય ધરણા કરીને આવેદનપત્ર આપવામાં ઉપાધ્યક્ષ અંબુભાઇ પટેલે તથા પ્રદેશ મહામંત્રી બાબુભાઇ પટેલે જણાવ્યું હતુ કે આવશે. જેમાં ફક્ત પોષણક્ષમ ભાવના સરકારે અમારી માગણીને ગંભીરતાથી ન મુદ્દાનો જ સમાવેશ કરવામાં આવશે. આજ રોજ અમદાવાદ ખાતે ભારતીય લેતા ભારતીચ કિસાન સંઘને આ પગલં

ઉઠાવવાની કરજ પડી છે. વડાપ્રધાનને ભારતીય કિસાન સંઘ દ્વારા જેપત્ર લખવામાં આવ્યો હતો તેમાં પોષણક્ષમ ભાવ, જાહેર ભાવથી ઓછા ભાવના વેચાણને ગુન્હો માનવામાં આવે, દરેક પ્રકારની ખરીદી ઓછામાં ઓછી એમએસપીથી જ થાય

બંધન બેંક લિમિટેડ

અધિકૃત અધિકારી

Bandhan રીજનલ ઑફિસઃ નેતાજી માર્ગ, મીઠાખળી છ રસ્તા પાસે, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬. કેક્સઃ ૯૧–૭૯–૨૬૫૬૦૬૪૯ | ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૫૩૦૦ વેબસાઇટ: www.bandhanbank.com વેચાણ નોટિસ ક્રમ ટેન્ડર માટેનું આમંત્રણ આ સાથે જાહેર જનતાને અને વિશેષ કરીને કરજદાર વેચાણ નોટિસ કમ ટેન્ડર માટેનું આમંત્રણ આપવામાં આવે છે કે નીચે જણાવેલ અચલ સંપત્તિ, કે જે પૂર્વ ગૃહ (હવે ''બંધન બેંક'')ને ગીરો મૂકવામાં આવેલ છે, તે વેચાણ માટે મૂકેલ છે. મિલકતના વેચાણ માટે આવશ્વક વિગતો શિડ્યુલમાં આપેલ છે. ડિમાંડ નોટીસની તારીખે અને કરજદારનું(ના) નામ, વેચાણમાં મુકાનાર મિલકત રિઝર્વ પ્રાઈસ અને ૩૧.૦૮.૨૦૨૧ના રોજ સિક્યોર્ક (સિક્યોર્ડ એસેટ)નું વર્ણન લોન ખાતા સં., ચકવવાપાત્ર કબ્જો મેળવ્યાની તારીખ, લેણાંની રકમ, જેમાં કરજદારે ઈએમડી ટેન્ડર રેફ. નંબર ચૂકવવાની થતી રકમ, ડિમાન્ડ નોટિસથી જે તે તારીખ સુધીના વધારાના વ્યાજ, ખર્ચ, દરો વગેરે સહિતની રકમ સામેલ છે શ્રી રમેશ ટી. સોલંકી બધી જ ચલ અને અચલ સ્થાવર સંપત્તિ આશરે ૬૫.03 ३।.७,९९,८३९/- डे 31.90,40,000/-શ્રીમતી મીતાબેત ચોરસ મીટર છે, જે રેંવન્યૂ સરવે નંબર કળ્ય/૧, કળ્ય/૪, જે ડિમાન્ડ નોટીસ ઈએમડી ઓફર રમેશભાઈ સોલંકી ક્લેટ નંબર ૪૦૧, ચોથો માળ, બરસાના રેસીડેન્સી, ઉંદેરા તા. 05.08.૨૦૧૫ ના ริ้มสาสา 90% કોચાલી રોડ, ઉદેરા, તાલુકો અને જિલો વડોદરા સ્થિત છે લોન ખાતા નંબર ૩૦૧/૯૧७૩ રોજ અને તા.૩૧.૦૮.૨૦૨૧, ના અને નીચે પ્રમાણે આવરિત છે. 20.09.2095 રોજ, રૂા.૧૫,૨૭,૫૫૭/– 309-594 ઉત્તરઃ ટાવર-જી, પૂર્વઃ સંલગ્ન સરવે નંબર પશ્ચિમઃ ફ્લેટ નંબર ૪૦૪, દક્ષિણઃ ફ્લેટ નંબર ૪૦૨ શ્રી ભરત રસિકલાલ જાની બધી જ ચલ અને અચલ સ્થાવર સંપત્તિ આશરે ૬૦૮ ચોરસ ३।.९,१८,९५५/- डे ३।.१२,५0,000/-ફૂટ (૫૬.૫૩ ચોરસ મીટર) છે અને ૩૧.૫૨ ચોરસ મીટર શ્રીમતી દીનાબેન ભરતફમાર જાની જੇ ડਿਮਾਰਤ ਗੋਟੀਸ ઈએમડી ઓકર લોન ખાતા નંબર ૩૦૧/૯૩૩૭ જમીનનો અવિભાજિત હિસ્સો રૅવન્યૂ સરવે નંબર ૬૮૪ પૈકી ମା. ବବ.୩୦.ବ୦૧૮ ମା ริ้มตา १०% ૧ અને ૬૮૪, દેવ રેસીડેન્સી, ફ્લેટ નંબર બી–૧૦૭, ઉંદેરા રોજ અને તા.૩૧.૦૮.૨૦૨૧, ના 92.02.2020 સામે, જિલ્લો વડોદરા સ્થિત છે અને નીચે પ્રમાણે આવરિત છે. 309-9030 રોજ, રૂા.૧૩,૯૨,૪૧૨/– ઉત્તરઃ લિફ્ટ, પૂર્વઃ કુપ્લેક્સની હૃદની શરૂઆત પશ્ચિમઃ પૅસેજ, દક્ષિણઃ ફ્લેટ નંબર બી/૧૦૬ ટેન્ડર ખોલવાની તારીખ અને ઉપરોક્ત મિલકતની અન્ય વિગતો નીચે બતાવ્યા મુજબ છે. ટેન્ડર કોર્મ કી રૂા.૧૦૦/- પ્રતિ ટેન્ડર, ''બંધન બેંક લિમિટેડ''ની તરફેણમાં બેન્કર્સ ચેક/ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ચુકવવાપાત્ર (નોન-રીફંડેબલ) ૧૩.૦૯.૨૦૨૧ સવારે ૧૦.૦૦થી સાંજે ૫.૦૦ સુધી મિલકતના સ્થળ તપાસની તારીખ ટેન્ડર સ્વીકારવાની છેલી તારીખ અને સમય ૨૩.૦૯.૨૦૨૧ના સાંજના ૫.૦૦ વાગ્યા સુધી બંધન બેંક લિમિટેડની રીજનલ ઓફિસ, નેતાજી માર્ગ, મીઠાખળી છ રસ્તા પાસે, એલિસબ્રિજ, અમદાવાદ–૩૮૦૦૦૬ ખાતે ચૂકવવાપાત્ર અર્નેસ્ટ મની ડિપોઝીટ ઓફર પ્રાઈસના ૧૦ ટકા જેટલી રકમ ટેન્ડર સાથે બેન્કર્સ ચેક/ડિમાંડ ડ્રાફ્ટ દ્વારા ''બંધન બેંક લિમિટેડ''ની તરફેણમાં (ઈએમડી) ટેન્ડર ખોલવાની તારીખ અને સ્થળ ટેન્ડર ૨૪.૦૯.૨૦૨૧ ના રોજ બંધન બેંકની રીજનલ ઓફિસમાં ઉપર જણાવ્યા અનુસાર ખોલવામાં આવશે ટેન્ડર ફોર્મ્સ અહીં મળશે બંધન બેંક લિમિટેડ એસએફ–૧, સેવોય કૉમ્પ્લેક્સ, ૬૩, દરિભક્તિ એક્સટેન્શન, એબીએસ ટાવરની સામે, જૂના પાદરા રોડ, વડોદરા – ૩૯૦ ૦૦૭ સંપર્ક વ્યક્તિનું નામઃ શ્રી વિકાસ નવાનગુલઃ ૯૪૨૮૨૨૩૯૫૪, શ્રી અમર વ્યાસઃ ૯૩૨૮૬૧૨૦૧૮ મિલકતનું વેચાણ "જ્યાં છે તેમ" અને "જેમ છે તેમ", "કોઈફેરબદલ નહીં" અને "જ્યાં જે કંઈ છે"ના આધારે થશે. મિલકત અનામત કિંમતથી નીચેની કિંમતે વેચાય નહીં એવું બની શકે. બેંક જણાવે છે કે બેંકને ગીરો મૂકાયેલ ઉપરોક્ત મિલકત વિશે કોઈ લિટિગેશન, વિવાદ ફાઇલ થયેલ દોય કે પેન્ડિંગ દોય તેવી કોઈ જાણકારી અમને મળી નથી.

કર્જદાર/ગીરો મૂકનાર સરકેસી એક્ટના સેક્શન ૧૩(૮) દેઠળ વેચાણ કન્ફર્મ થવાની તારીખ સુધી ગીરો પરત મેળવી શકે છે. વેચાણ કમ ટેન્ડરના આમંત્રણની વિગતવાર શરતો અને નિચમો માટે અમારી વેબસાઇટ www.gruh.com\tender જોવા વિનંતી.

તારીખ: ૦૪/૦૯/૨૦૨૧ સ્થળઃ વડોદરા




GFL LIMITED (CIN: L24110GJ1987PLC009362)

Registered office: Survey No 16/3, 26 & 27, Village Ranjitnagar, Taluka Ghoghamba, District Panchmahal, Gujarat - 389380 Telephone: +91 1123354795 Website: www.gfilimited.co.in Email id: secretarial@inoxmovies.com

<u>વિડીચો કોન્ફરન્સીંગ / અધર ઓડિચો વિઝ્યુઅલ મીન્સ દ્વારા ચોજાનાર ૩૪મી વાર્ષિક સામાન્ય સભા (AGM) અંગેની માहિતી</u>

આથી ખબર આપવામાં આવે છે કે GFL લિમિટેડ (કંપની) ના સભ્યોની વાર્ષિક સામાન્ય સભા (AGM), AGMની નોટીસમાં દર્શાવ્યા મુજબ, ઘંધાકીય વૃદ્ધીવટ કરવા વિડીયો કોન્ફરન્સીંગ (VC) / અધર ઓડિયો વીઝ્યુઅલ મીન્સ (OAVM) લારા મંગળવાર ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના બપોરે ૧૨:૦૦ વાગે (IST)યોજવા નક્કી કરાયેલ છે. સતત કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લેતાં, મિનીસ્ટ્રી ઓફ કોરપોરેટ અફેર્સ (MCA) એ ્તા. ૮/૪/ ૨૦૨૦ના જનરલ પરિપત્ર ન. - ૧૪/ ૨૦૨૦, તા. ૧૩/૪/ ૨૦૨૦ ના ૧૭/૨૦૨૦ અને તા. ૧૩/૧/૨૦૨૧ના ૦૨/૨૦૨૧ સાથે વંચાતા તા. ૦૫/૦૫/૨૦૨૦ના તેના જનરલ પરિપત્ર નં. - ૨૦/૨૦૨૦ અન્વચે (સંચુક્ત રીતે MCA પરિપત્રો તરીકે ઉક્ષેખ છે) તથા તા. ૧૨/૦૫/૨૫૦૨૦ ના પરિયત્ર નં. સેબી/HO/CFD/CMDI/CIR/2020/!9 તથા તા. ૧૫/૦૧/૨૦૨૧ના પરિયત્ર નં સેબી /HO/CFD/CMDI /CFD/CMD2/CIR/P/૨૦૨૧/૨૨ (સેબી પરિપત્રો) અન્યચે સિક્યુરીટીઝ એન્ડ એક્સેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ, સામાન્ય સ્થળે સભ્યોની ભૌતિક હાજરી વિનાં, VC/OAVM દ્વારા AGM ચોજવાની પરવાનગી આપી છે. VC/OAVM દ્વારા ભાગ લેતા સભ્યોની એક્ટની કલમ ૧૦૩ દેઠળ કોરમના દેતુ માટે ગણતરી કરવામાં આવશે. સભ્યોદ્વારા પ્રોક્સીઓની નિમણૂંક માટેની સુવિધા ઉપલબ્ધ રદેશે અંદર્/ OAVM દ્વારા બાગ લાગ સાવ્યાના અકદના કહેવા ૧૦૩ છેલ્લા કાર્યના છું માટે ગંહારા કરવામાં આવવા. સાચ્યાભાગ માંગણૂક માટેલા સાવવા ઉપલબ્ધ રહેવા નહીં, કારણકે AGM VC/OAVM દ્વારા યોજાઇ રહેલ છે. MCA પરિપત્રો અને સેબી પરિપત્રો ના અનુરૂપમાં, નાણાંકીચ વર્ષ ૨૦૨૦-૨૧ માટેના વાર્ષિક અદેવાલ તથા AGMની નોટીસના પ્રચાર, પ્રસારના અનુપાલનમાં મુજબ નાણાંકીચ વર્ષ ૨૦૨૦-૨૧ માટેના તેની પરના ઓડીટર્સના અદેવાલો સાથે ઓડીટેડ કોન્સોલીડેટેડ નાણાંકીચ પરિણામો, સ્ટેટમેન્ટ્સ, તેની પરના ઓર્ડ ઓફ ડાયરેક્ટરો તથા ઓડિટરોના અદેવાલો સાથે ઓડિટેડ નાણાંકીચ સ્ટેટમેન્ટ્સ સમાવિષ્ટ છે, જે કંપનીની સાથે અથવા લિન્ક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રા. લિ. (કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ્સ) / ડીચોજીટરી પાર્ટીસીપન્ટ્સ સાથે જેઓના Ds નોંધાચેલા છે તેવા તમામ સભ્યોને ઇલેક્ટ્રોનિક મોડમાં તા. ૦૩/૦૯/૨૦૨૧ના રોજ સંપૂર્ણ કરાચેલ છે. ૩૪મી AGM ની નોટીસ તથા નાણાંકીચ વર્ષ ૨૦૨૦-૨૧ માટેનો વાર્ષિક અદેવાલ "ઇન્વેસ્ટર સેક્શન દેઠળ કંપનીની વેબસાઇટ એટલે કે www.gfllimited.co.in ઉપર તથા જયાં કંપનીના શેર્સ યાદી કરાચેલ છે તે સ્ટોક્ એક્સચેન્જોની વેબસાઇટો એટલે કે ખાતે http://www.bseindia.com ખાતે નેશનલ સ્ટોક એક્સચેન્જની વેબસાઇટો એટલે કે http://www.nseindia.com ઓફ ઇન્ડિયા લિમિટેડ ઉપર તેમજ www.evotingindia.com ખાતે સેન્ટ્લ ડીપોઝિટરી સર્વિસીઝ (ઇન્ડિયા) લિમીટેડ (CDSL) ની વેબસાઇટ ઉપર પણ અપલોડ કરાયેલ છે. સભચો માત્ર VC/OAVM સુવિધા દ્વારા જ AGM માં દાજર રહી શકશે અનેભાગ લઈ શકશે. AGMમાં જોડાવા માટેની સૂચનાઓ AGM ની નોટીસમાં દર્શાવેલ છે. VC/OAVM દ્વારા ભાગ લેતા સભ્યોની એક્ટની કલમ ૧૦૩ દેઠળ કોરમના દેતુ માટે ગણતરી કરવામાંઆવશે. સભ્યો દ્વારા પ્રોક્સીઓની નિમણૂંક માટેની સુવિધા ઉપલબ્ધ રહેશે નદિ, કારણ કે VC/OAVM દ્વારા ચોજાઈ રહેલ છે. નોટીસ અને વાર્ષિક અદેવાલ પ્રાપ્ત કરવા માટે, સભ્યોને વિનંતી છે કે તેઓએ અગાઉ નોંધણી કરાવી નદિ દોય / સદર અપડેટ કરાવ્યું નદિ દોય તો તેવી બાબતમાં તેમના ડીપોઝીટરી પાર્ટીસીયન્ટસ જોડે તેમના ઇ-મેઇલ સરનામાં નોંધાવી લે / અપડેટ કરાવી લે. સભ્યો જેઓ શેર્સ ભૌતિક રૂપમાં ધરાવે છે તેઓને વિનંતી છે કે vado dara@linktime.co.in ખાતે ઇમેલ મોકલાવીને રજીસ્ટ્રાર એન્ડ શેર ટ્રાન્સફર એજ (RTA) જોડે તેમના ઈ-મેલ સરનામાં નોંધાવી લે. ઇલેક્ટ્રોનીફલી AGM માટે નોટીસ પ્રાપ્ત કરવા અને ઇલેક્ટ્રોનીકલી મત આપવા માટે હંગામી રીતે ઇમેઇલ સરનામાં રજીસ્ટર કરવાની પ્રક્રિયા (ઇમેલ આઇડી નોંધાયેલના હોય તેવી બાબતમાં) : અ) ભીતિક રૂપમાં શેર્સ ધરાવતા સભ્યો માટે : secretarial@inoxmovies.com ખાતે કંપનીને / vadodara@linktime.co.in ખાતે RTA ને ઇમેલ કરીને કૃપયા આવશ્યક વિગતો મોકલાવી જેવી કે ફોલિયો નં. સભ્યનું નામ, શેર સર્ટિફિકેટની સ્કેન કરેલ કોપી (આગળની અને પાછળની), PAN (PAN કાર્ડની સેલ્ફ-એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી), આધાર (આધાર શાર્ડની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી) બ) ડીમેટ ફોર્મમાં શેર્સ ધરાવતા સભ્યો માટે secretarial@inoxmovies.com ખાતે કંપનીને /vadodara@ linktime .co.in ખાતે RTA ને કૃપા કરી ડીમેટ ફોર્મમાં શેર્સ ધરાવતા સભ્યો માટે secretarial@inoxmovies.com ખાતે કંપનીને /vadodara@ linktime .co.in ખાતે RTA ને કૃપા કરી ડીમેટ એકાઉન્ટની વિગતો મોકલવી. (CDSL- ૧૬ ડીજીટ બેનીફીશીચરી ID અથવા NSDL - ૧૬ ડીજીટ DPID + CLID) નામ, કોન્સોલીકેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટની કલાચન્ટ માસ્ટર અથવા કોપી, PAN (PAN પાનકાર્ડની સેલ્ફ-એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી), આધાર (આધારકાર્ડની સેલ્ફ-એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી) સાલ્યો માત્ર VC/OAVM સુવિધા બ્રારામાં AGM હાજર રહી શકે એને ભાગ લઈ થારે શ્રે અલે માં સેડાવા માટે સ્વાનઓ AGM ની નોટીસમાં દર્શાવેલી છે. અલ્વો માત્ર VC/OAVM સુવિધા બ્રારામાં AGM હાજર રહી શકે અને ભાગ લઈ થારે શ્રે અલિમ માં સેડાવા માટે સ્વાનઓ AGM ની નોટીસમાં દર્શાવેલી છે. સભ્યોનેCDSL ઇન્વોટીંગ સિંસ્ટમ દ્વારા VC/OAVM દ્વારા AGM માં હાજર રહેવા માટે સુવિધાની જોગવાઇ કરાયેલ છે. સભ્યો, રીમોટ ઇ-વોટીંગ, ફ્રીડેન્શીયલ્સનો ઉપયોગ કરી મેમ્બર્સ લોગઇન દેઠળ <u>http://www.evoting.india.com</u> ખાતે સદર એસેસ, પ્રવેશ કરી શકશે. VC/OAVM માટેની લિંક શેરધારક / મેમ્બર્સ લોગઇનમાં ઉપલબ્ધ રહેશે જ્યાં કંપનીની EVSN પ્રદર્શિત કરાશે. રહેશ જ્યાં કેપબાળા દેપ કાર્યા. આજ દિન સુધી સુધારા મુજબ, કંપનીજ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ ૨૦૧૪ના નિયમ ૨૦ સાથે વંચાતા એક્ટની કલમ ૧૦૮ની જોગવાઇઓ સાથેના અનુરૂપમાં લિસ્ટીંગ રંગ્યુલેશન્સના રંગ્યુલેશન ૪૪, સુધાર્યો મુજબ અને MCA પરિપત્રોના અનુપાલનમાં, કંપની AGM ની નોટીસમાં દર્શાવેલા તમામ ઠરાવોની બાબતમાં તેના સભ્યોની AGM ખાતે ઇ-વોટિંગ તેમજ રિમોટ ઇ-વોટિંગની સુવિધાની જોગવાઇ કરી રહેલ છે. આ હેતુ માટે કંપનીએ અધિકૃત ઇ-વોર્ટિંગ્સ એજન્સી તરીકે ઇલેક્ટ્રોનિકના પ્રકાર દ્વારા વોર્ટિંગની સુવિધા માટે સેન્ટ્રલ ડીપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL) સાથે કરાર કર્યા છે. સભ્યોને, AGM ખાતે VC/OAVM પ્રોસીડિંગ્સ દરમ્યાન ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ ક્રારા વોટિંગ માટે સુવિધાની જોગવાઈ કરાશે અને AGM ખાતે ભાગ લેતા સભ્યો, જેઓએ રીમોટ ઇ-વોટિંગ ક્રારા તેમના મત અગાઇ આપ્યા છે, તેઓ AGM ની આવી પ્રોસીડિંગ્સ દરમ્યાન મત આપવા માટે તેમનો ઠક્ક વાપરવા માટે દક્કદાર રહેશે. સભ્યો AGM ની અગાઉ રિમોટ ઈ-વોર્ટિંગ દ્વારા તેમનો મત આપ્યો હશે તેઓ પણ AGM માં ભાગ લેવા લાયક રહેશે પરંતુ કરીથી તેમનો મત આપવા હક્કદાર રહેશે નહીં. ઈ-વોર્ટિંગ દ્વારા મત આપવાની વિગતવાર સૂચનાઓ AGM ની નોટીસમાં દર્શાવેલી છે. તમામ સભ્યોને વિનંતી છે કે ઈ-વોર્ટિંગના નીચેના શેડપુલની નોંધ લે.



LACTOSE લેકટોસ (ઈર્ડિયા) લિમિટેડ e (INDIA) LIMITED સીઆઈએન: એલ૧૫૨૦૧જીજે૧૯૯૧પીએલસીઓ૧૫૧૮૬, મુશ્લેલ્લે Epper House સીઆઈએન: સર્વે નં.૬, ગામ પોઈથા (૨ાણીયા) તાલુકો સાવલી,વડોદરા ગુજરાત ૩૯૧૭૮૦ કોર્પોરેટ કાર્યાલય: જી -૨, એ વિંગ નવભારત એસ્ટેટ, ઝકરીયા બંદર રોડ, સેવરી (વેસ્ટ), મુંબઇ ૪૦૦૦૧૫. સંપર્ક:૦૨૨-૨૪૧૧૭૦૩૧ ફેક્સ:૦૨૨-૨૪૧૧૭૦૩૪ ઇમેઇલ : Ili@lactoseindialimited.com; વેબસાઇટ : www.lactoseindialimited.com

૩૦ વાર્ષિક સામાન્ય મીટિંગની સૂચના

આ જણાવવાનું છે કે કોવિડ -૧૯ રોગચાળાના પ્રકોપને ધ્યાનમાં રાખીને, ૩૦ મી વાર્ષિક સામાન સભા (AGM) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કંપનીનું આયોજન કરવામાં આવશે (VC) / અન્ય ઓડિયો-વિઝયુઅલ મીન્સ (OAVM) ગુર્વાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે કંપની એક્ટ, ૨૦૧૩ ની તમામ લાગુ જોગવાઈઓ અને તેના હેઠળ બનાવેલા નિયમો અને સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ અને ડિસ્કલોઝર રિકવાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫, (સેબી લિસ્ટિંગ રેગ્યુલેશન્સ) અને એમસીએનો ૧૩ મી જાન્યુઆરી, ૨૦૨૧ નો પરિપત્ર અથવા એપ્રિલ, ૨૦૨૦, ૧૩ મી એપ્રિલ, ૨૦૨૦, ૦૫ મી મે, ૨૦૨૦, ૨૮ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ અને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ (એમસીએ સર્ક્યુલર્સ) એજીએમને નોટિસમાં બહાર પાડવામાં આવેલા વ્યવસાયની લેવડદેવડ કરવા માટે. ૩૦ મી એજીએમ માટે ડીમ્ડ સ્થળ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ હશે.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ (વાર્ષિક અહેવાલ) માટે વાર્ષિક અહેવાલ સાથે AGM બોલાવવ માટેની સુચના ફક્ત તે સભ્યોને ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા મોકલવામાં આવશે જેમના ઇમેઇલ સરનામાં ડિપોઝિટરી સહભાગી (DPs)/કંપની/સાથે નોંધાયેલા છે. એમસીએ પરિપત્ર અને સેબીના નિયમે બનુસાર રજિસ્ટ્રાર અને ટ્રાન્સકર એજન્ટ બિગ શેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ (આરટીએ) ભૌતિક મોડમાં શેર ધરાવતા સભ્યો, જેમણે કંપની સાથે તેમના ઇમેઇલ સરનામાં અથવા મોબાઇલ નંબર રજીસ્ટર / અપડેટ કર્યા નથી, તેમને https: //bigshareonline.connll nvestorRegistration.aspx # AdvdTrack # પર ક્લિક કરીને નોંધણી / અપડેટ કરવા વિનંતી કરવામાં આવે છે અને જે સભ્યો ડિમટીરિયલાઇઝ્ડ ફોર્મમાં શેર છે અને હજૂ સુધી નોંધાયેલા નથી તેમના ઇ-મેઇલ સરનામાંઓ તેમના ડીપી સાથે નોંધણી કરવા વિનંતી કરવામાં આવે છે. સભ્યો એજીએમમાં માત્ર વિડીયો કોન્ફ્રન્સિંગ (VC) / અન્ય ઓડિયો-વિઝ્યુઅલ મીન્સ (OAVM) દ્વારા ભાગ લઈ શકે છે અને ભાગ લઈ શકે છે. VC/OAVM દ્વારા AGM માં જોડાવા માટેની પ્રક્રિયા અથવા સૂચનાઓ નોટિસમાં જણાવવામાં આવી છે. AGM દરમિયાન તમામ સભ્યો (ભૌતિક સ્વરૂપમાં શેર યરાવતા સભ્યો/જેમના ઇ-મેઇલ સરનામાં ડીપી/કંપની/આરટીએ સાથે નોંધાયેલા નથી) સહિત રિમોટ ઇ-વોટિંગ અથવા ઇ-વોટિંગ દ્વારા મત આપવા માટેની વિગતવાર પ્રક્રિયા અથવા સૂચનાએ માં જણાવવામાં આવ્યું છે. સચના. આ જાહેરાત કંપનીની વેબસાઇટ www.lactoseindialimited.com અને સ્ટોક એક્સચેન્જર્ન

બસાઇટ www.bseindia.com પર પણ ઉપલબ્ધ રહેશે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી લેક્ટોઝ (ઇન્ડિયા) લિમિટેડ તારીખ: ૦૩ 'સપ્ટેમ્બર, ૨૦૨૧ એસડી/-અતુલ મહેશ્વરી મેનેજિંગ ડિરેકટર સ્થળ: મુંબઈ



વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ લીમીટેક

CIN: L31100GJ1967PLC001437

રજી. ઓર્કીસ : મકરપુરા, વડોદરાફકેલ્ટ૦૧૪, ગુજરાત (ઇન્ડીયા) કોર્ચ : +91 265 2642011 / 2642012 / 3041480, કેમ્ન : +91 265 2646774 / 3041499 ย์-นี้ยัง : voltamp@voltamptransformers.com, นิ่งเงเช่2 : www.voltamptransformers.com

નોટીસ


આથી સભાસદોને સુચના આપવામાં આવે છે કે કંપનીની પ૪મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) તા. ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના ગુરૂવારના રોજ સવારે ૧૦ :૦૦ કલાકે (IST) વીડિયો કોન્ફરન્સ ('VC') અથવા અન્ય વીડિયો ("OAVM") મારકતે યોજાશે કંપીઝ એકટ, ૨૦૧૩ ("The Act") જોગવાઈ સાથ પાલન અને તેના નિયમો, સુધારેલા, સામાન્ય પરિપત્ર નં ૧૪/૨૦૨૦, ૮મી એપ્રીલ, ૨૦૨૦ ના સામન્ય પરિષત્ર નં. ૧૭/૨૦૨૦ તા. ૧૩મી એપ્રીલ, ૨૦૨૦ અને સામાન્ય પરિપત્ર નં.૨૦/૨૦૨૦ તારીખ ૫મી મે, ૨૦૨૦ પરિપત્ર ૦૨/૨૦૨૧ તા. ૧૩, જાન્યુઅરી, ૨૦૨૧ (એમસીએ પરિષત્રો) સેબી/એચઓ/સીએકડી/સીએમડી૧/સીઆઇઆર/પી/૨૦૨૦/૭૯ સાથે ૧૨મી મે, ૨૦૨૦ના રોજના પરિપત્રના વાંચન સાથે અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રિકવાયરમેન્ટ્સ) રેગ્યલેશન્સ, ૨૦૧૫ સાથે સયોજીત વ્યવસાયોની લેવડદેવડ માટે ૫૪મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) યોજવામાં આવી છે.

એમસીએ પરિપત્રો અને સેબી પરિપત્રોના પાલન માટે, બેઠકમાં વ્યવહારો કરવા માટે એજીએમ બોલાવવા નોટીસ અને નાંણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના ૫૪ મા વાર્ષિક અહેવાલ સાથે તે સાથે જોડાયેલ સ્પષ્ટીકરણ નિવેદન, તે શેરધારકોને ઇલેક્ટ્રાનિક મોડ દ્વારા મોકલવામાં આવ્યું જેની ઇમેઇલ આઇડી ડિપોઝિટરીઝ / કંપનીમાં નોંધાયેલ છે. વધુમાં કંપનીએ તેની વેબસાઇટ www.voltamptransformers.com પર અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ એટલે કે BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જઓફ ઇન્ડીયા લિમિટેડ પર અનક્રમે www.bseindia.com અને www.nseindia.com ની પણ નોટીસ અને વાર્ષિક અહેવાલ અપલોડ કર્યો છે, અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીઝ લિમિટેડ (NSDL') ની વેબસાઇટ દૂરસ્થ ઇ-મતદાન, VC/OAVM મારફતે એજીએમમાં ભાગ લેવા અને www.evoting.nsdl.com.પર એજીએમ દરમ્યાન ઇ-મતદાનની સવિધા ઉપલબ્ધ છે.

કરજણ નગરપાલિકા, કરજણ દુકાનોની જાહેર હરાજી અંગેની જાહેર નિવિદા

કરજણ નગરપાલિકા જી. વડોદરાની કચેરી તરફથી કરજણ નગરપાલિકાના નવાબજાર વિસ્તારમાં ઇન્દુભાઇની જીન પાસે, ભરતમુનિ નગરગૃહની પાછળ આવેલ ફાઇનલ પ્લોટ નંબર-૫૧૦ ટી.પી. સ્કીમ નં.-૨માં ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ માળે દુકાનો/ઓફીસોનું તેમજ બીજા મજલે નગરપાલિકા ઓફીસ બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવેલ છે. સદરહું શોપીંગ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરમાં બાકી રહેલ-૧૧ દુકાનો/ઓફિસો તથા પ્રથમ માળની - ૨૫ દુકાનો/ઓફિસોની ભાડાપટ્ટાથી નિકાલ કરવા માટે તા. ૧૪-૦૯-૨૦૨૧ના રોજ સવારના ૧૦.૩૦ કલાકે શોપીંગ કોમ્પલેક્ષના કમ્પાઉન્ડમાં જાહેર હરાજી રાખવામાં આવેલ છે. તો રસ ધરાવતા સબંધિત તમામ વેપારી મિત્રો તથા નગરજનોને દુકાનોની જાહેર હરાજીમાં ભાગ લેવા જણાવવામાં આવે છે. હરાજીમાં ભાગ લેવા માટેની શરતો નગરપાલિકાના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવેલ છે. તથા જે કોઇ ઇસમોને હરાજી અંગેની વિસ્તૃત માહિતીની જરૂરત હોય તો તે અંગેની સઘળી માહિતી નગરપાલિકાના બાંધકામ વિભાગમાંથી રૂબરૂમાં આપવામાં આવશે. તેમજ હરાજીમાં ભાગ લેવા એક દુકાન દીઠ રૂા. ૨૫,૦૦૦/- (એક રૂપિયા પચ્ચીસ હજાર પુરા) ની સિક્યોરીટી ડિપોઝીટ જાહેર નિવિદા પ્રસિદ્ધ થયા તારીખથી તા. ૧૩-૦૯-૨૦૨૧ સુધીમાં નગરપાલિકા કચેરીમાં રોકડેથી અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા નગરપાલિકા કચેરી સમય દરમ્યાન એટલે કે, સવારના ૧૦.૩૦ થી સાંજના ૬.૧૦ કલાક સુધી ભરપાઇ કરવાની રહેશે. તેમજ ચાલુ હરાજીમાં જે તે ઇસમને દુકાન મળેલ હશે અને તે ઇસમ કરીથી અન્ય નંબરની દુકાનની હરાજીમાં ભાગ લેવો હશે તો કકત તે જ ઇસમ ફરીથી ડિપોઝીટ પેટે રૂા. ૨૫,૦૦૦/- ભરી ચાલુ હરાજીમાં ભાગ લઇ શકશે. કોઇપણ એક, એક થી વધુ અથવા તમામ દુકાનોની આખરી હરાજી કિંમત મંજૂર/નામંજૂર કરવાની સત્તા નગરપાલિકાની અબાધિત રહેશે.

સ્થળ :- કરજણ તા. ૦૧/૦૯/૨૦૨૧ (જયકિશન એમ. તડવી) (વનરાજસિંહ એમ. રાઉલજી) (મીનાબેન જે. ચાવડા) ચીફ ઓફિસર ચેરમેન પ્રમુખ કારોબારી સમિતિ કરજણ નગરપાલિકા કરજણ નગરપાલિકા (માહિતી-વડો-૬૪૬-૨૧-૨૨)



સિસ્ટમથી આપી શકશે. આથી તમામ સદસ્યોને જણાવવમાં આવે છે કે:

એજીએમમાં રીમોટ ઈ-વોર્ટીંગ અથવા ઈ-વોર્ટીંગ થી એજીએમની સૂચનામાં જણાવેલા હાથ ધરવા માટેના વ્યવહારોને લગતી કામગીરી થશે.

| વિગતો | વારીખ |
|--|--|
| નોટીસ મોકલવાની પૂર્ણ કરવાની તારીખ | શકવાર, તા. ૦૩/૯/૨૦૨૧ |
| રીમોટ ઈ-વોર્ટિંગની શેરૂઆતની તારીખ અને સમય | શॅનિવાર, તા. ૨૫/૯/૨૦૨૧ ના સવારે ૯:૦૦ કલાકે |
| રીમોટ ઈ-વોર્ટિંગની બંધ થવાની તારીખ અને સમય | સોમવાર, તા. ૨૭/૯/૨૦૨૧ ના સાંજે ૫:૦૦ કલાકે |
| કટ-ઓફ તારીખ | મંગળવાર, તા. ૨૫/૯/૨૦૨૧ ના કે તે પહેલા |
| પરિણામના જાહેરાતની તારીખ | ગુરૂવાર, તા. ૩૦/૯/૨૦૨૧ ના કે તે પહેલા |

ઈ-વોર્ટિંગ મોડ્યુલ વોર્ટિંગ, મત આપવાના ઉપરના જણાવેલ તારીખ અને સમય પછી CDSLદ્ધારા સમર્થ બનાવાશે નર્દિ. અને એકવાર સભ્ય દ્વારા ઠરાવ પર મત અપાશે, સભ્યને ત્યારપછી ફેરફાર કરવાની પરવાનગી રદેશે નર્દી.

વ્યક્તિએ જેઓના નામ કટ-ઓફ તારીખ એટલે કે મંગળવાર ૨૧/૯/૨૦૨૧ના રોજ ડીપોઝીટરીઝ દ્વારા મેઇન્ટેન કરાતા બેનિફિશીચલ ઓનર્સના રજીસ્ટરમાં અથવા સભ્યોના રજીસ્ટરમાં રેકોર્ડ થચેલા દશે, માત્ર તેઓને AGM માં મત આપવા તેમજ રીમોટ ઇ-વોર્ટિંગની સુવિધાનો લાભ લેવા દક્કદાર રદેશે. કોઇપણ શખ્સ જેઓ નોટીસને મોકલ્યા પછી કંપનીના શેર્સ સંપાદ્ન કરશે અને કંપનીના સભ્ય બનશે અને કટ-ઓફ તારીખના રોજ શેર્સ ધરાવતા દશે તેઓએ AGM નોટીસમાં દર્શાવ્યા મુજબની ઇ-વોર્ટિંગની એજ પધ્ધતિનું અનુસરણ કરવું પડશે.

ઇ-વોર્ટીંગ સંબંધી આપને કોઇપણ ફરિયાદ હોય તો કૃપયા <u>www.evotingindia.com</u> ખાતે ઉપલબ્ધ ઇ-વોર્ટીંગ મેન્યુઅલ / ફ્રીક્વન્સી આસ્કડ કવેશ્યન (PAQS) રીફર કરો અથવા helpdesk.evoting@cdslindia.com તે ઇમેઇલ લખો અથવા નીચે સહી કરનારનો સંપર્ક કરો. બૉર્ડ ઑક ડિરેક્ટરર્સના હકમથી બોર્ડ ઓફ ડિરેક્ટરર્સના હકમથી

| સ્થળ : વડોદરા | | | |
|---------------------|-----|--|--|
| તા.૩ સપ્ટેમ્બર, ૨૦૨ | 29. | | |
| | | | |

વધમાં સુચના આપવામાં આવે છે કે, કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૯૧ અને લાંગુ પડેતા નિયમો અનુસાર તેમજ રેગ્યુલેશન ૪૨ ના સેબી (લીસ્ટીંગ ઓબલીગેસન અને ડીસક્લોસર રીકવારમેન્ટ) રેગ્યુલેશન, ૨૦૧૫ ના નિયમ ૪૨ મુજબ સભાસદોનું રજીસ્ટર તથા કંપનીના શેર ટ્રાન્સકર બુકસ તા. ૨૪મી સપ્ટેમ્બર ૨૦૨૧ શુક્રવાર થી તા. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૧ ગુરૂવાર સુધી (બંને દિવસ સંકલિત) બંધ રહેશે. સભાસદોએ વાર્ષિક સામાન્ય સભામાં પોતાનો મત રીમોટ ઇ-વોર્ટીંગ અથવા ઇ-વોર્ટીંગ દ્વારા સભ્યોને મત આપવાની પાત્રતા નક્કી કરે છે.

વધુમાં, કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૦૮, કંપની (સંચાલન અને વહિવટ) નિયમો, ૨૦૧૪, કંપનીઝ (સંચાલન અને વહિવટ) સુધારેલા નિયમો, ૨૦૧૫ અને રેગ્યુલેશન ૪૨ ના સેબી (લીસ્ટીંગ ઓબલીંગેસન અને ડીસક્લોસર રીકવારમેન્ટ) રેગ્યુલેશન, ૨૦૧૫ મુજબ :

- ૧. તા. ૨જી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા મોકલવાની વાર્ષિક અહેવાલ સાથે એજીએમની નોટીસ કાર્યવાહી પૂર્ણ થયેલ છે.
- ર. રીમોટ ઇ-વોટીંગ નો સમય ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સોમવાર ના રોજ (સવારે ૯:૦૦ કલાકે) (IST) થી શરૂ થઇ ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૧ બધવારના રોજ (સાંજે ૫:૦૦ કલાકે) સમાપ્ત થશે. આ સમય બાદ રીમોટ ઈ-વોર્ટીંગ મોડ્યુલ મતદાન માટે એનએસડીએલ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે.
- 3. જે સભાસદોનું નામ કટ~ઓફ તા. ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના ગુરૂવારના રોજ સભાસદ રજીસ્ટરમાં અથવા ડીપોઝીટરીસ દ્વારા જાળવવામાં આવેલ લાભદાયી માલિકોના રજીસ્ટરમાં ડશે. તે સભાસદો રીમોટ ઇ-વોર્ટીંગની સુવિધા મેળવવા માટે તેમજ સામાન્ય સભામાં મતદાન માટે હક્કદાર રહેશે.
- ૪. જે વ્યક્તિએ, કંપનીના શેર નોટીસ પોસ્ટ કર્યા પછી લીધા હોય અને કટ-ઓફ તા. ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧, બુધવારના રોજ કંપનીના સભાસદ હોય, તેઓ evoting@nsdl.co.in અથવા vadodara@linkintime.co.in પર વિનંતી મોકલીને લોગીન આઇ ડી અને પાસવર્ડ મેળવી શકે છે.
- સભ્યો એજીએમની નોટીસની નોંધ નંબર ૮ માં ઉલ્લેખિત ઇ-વોટીંગની સૂચનાઓ માંથી પસાર થઇ શકે છે અને કોઇ પણ પક્ષોના (FAQs) કિસ્સામાં, સભ્યો માટે વારંવાર પૂછાતા પ્રજ્ઞો www.evoting.nsdl.com પર ડાઉનલોડ સેકશન પર ઉપલબ્ધ છે સભ્યો માટે ઇ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઇ શકે છે.

દ. સભ્યો ને જાણ કરવામાં આવે છે કે :

એ). VC/OAVM સવિધા મારકતે એજીએમમાં ભાગ લેનાર જેમણે દૂરસ્ત દ્વારા તેમના મત આપ્યો નથી, તેઓ એજીએમમાં ઇ-વોટિંગ દ્વારા મત આપવા માટે હક્કદાર રહેશે.. બી). જે સભ્યો એજીએમ પહેલાં રીમોટ ઇ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો છે તેઓ પણ એજીએમમાં હાજરી આપી શકશે પરંતુ

બેઠકમાં ફરી પોતાનો મત આપવા માટે હક્કદાર રહેશે નહી. ૭. કંપનીની એજીએમની સુચના અને અન્ય બાબતો સાથે સાથે ઇ-વોટિંગની પ્રક્રિયા અને વીસી/ઓવીએની સુવિધા દ્વારા એજીએમમાં હાજરી અપાતી, એનએસડીએલ ની વેબસાઇટ https://www.evoting.nsdl.com અને

- કંપનીની વેબસાઇટ www.voltamptransformers.com અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ એટલે કે BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડીયાની વેબસાઇટ www.bseindia.com and www.nseindia.com પર ઉપલબ્ધ છે.
- ૮. સભાસદો કોઇ પુછપરછ માટે, www.evoting.nsdl.com ના ડાઉનલોડ સેક્શનમાં ઉપલબ્ધ સભાસદો માટેના વાંરવાર પૂછાતા પ્રશ્નો (FAQs) અને ઇ-વોર્ટીંગ યુઝર મેન્યુઅલનો સંદર્ભ લઇ શકે છે અથવા તો ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૦૨૦-૯૯૦ અથવા ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦ પર સંપર્ક કરી શકે છે અથવા તો ઇ-વોટીંગના evoting@nsdl.co.in પર પોતાની ફરીયાદ મોકલી શકે છે કે જેઓ ઈલેકટ્રોનિક વોર્ટીંગ ને લાગતી ફરીયાદોનો નીકાલ કરશે. બોર્ડના હક્ષ્મથી

વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ લીમીટેક

સ્થળ ઃ વડોદરા સંકેત રાઠોડ તા. 03/0૯/૨૦૨૧ કંપની સેક્રેટરી

- એજીએમમાં રીમોટ ઈ-વોર્ટીંગ અથવા ઈ-વોર્ટીંગ સિસ્ટમથી મતદાન કરવા માટેની પાત્રતા નક્કી કરવા માટેની કટ ઓફ ડેટ ગુરૂવાર, તા.૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ નક્કી કરવામાં આવી છે.
- રીમોટ ઈ-વોટીંગનો પ્રારંભ સોમવાર, તા.૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ સવારના ૯.૦૦ વાગે (આઈએસટી) થશે.
- iv. રીમોટ ઈ-વોટીંગ બુઘવાર, તા.૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ સાંજના ૫.૦૦ વાગે (આઈએસટી) પૂર્ટ થશે.
- રીમોટ ઈ-વોટીંગ મોડ્યુલ બુંઘવાર, તા.૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ સાંજના ૫.૦૦ વાગ્યા પછી બંધ કરવામાં આવશે.
- vi. જે સદસ્યો ભોતિક મોડમાં શેર ઘરાવે છે અને વ્યક્તિગત શેરહોલ્ડર ના હોય એવા શેરધારકો જેઓ સૂચના જારી કર્યા પછી કંપનીના શેર મેળવે છે અને કંપનીના સદસ્ય બને છે તથા કટ ઓફ ડેટ એટલે કે તા.૨૩મી સપ્ટેમ્બર, કપનાના સરસ્ય બન છ લયા કર ગાર કર કરવા માટે, ૨૦૨૧ના રોજ કંપનીના શેર ઘરાવે છે, તેઓ મતદાન કરવા માટે, helpdesk.evoting@cdslindia.com ને વિનંતી મોકલીને લોગીન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. પરંતુ જો કે તે કે તેણીની રીમોટ ઇધોરીંગ/ઈ-વોરીંગ માટે સીડીએસએલ સાથે નોંધણી ઘરાવતા હોય તો મત આપવા માટે તે પ્રવર્તમાન યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકશે. વ્યક્તિગત શેરધારકો જેઓ ડિમટે સ્વરૂપમાં સિક્યોરીટીઝ ધરાવે છે અને નોટીસ મોકલ્યા પછી કંપનીના શેર મેળવે છે અને કટ ઓફ ડેટ તા.૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ કંપનીના શેર ધરાવે છે, તે એજીએમની નોટીસના મુદ્દા નં.૯ને અનુસરીને જરૂરી કાર્ચવાહી કરી શકે છે.
- vii. સદસ્યો નોંધ લે કે :
 - (અ) સદસ્ય એક વાર ઠરાવ ઉપર મત આપીદે પછી એ સદસ્યને મત બદલવાનો અધિકાર નથી.
 - એજીએમમાં પણ મત આપવાની વ્યવસ્થા રાખવામાં આવશે અને વીસીના માધ્યમથી જેઓ એજીએમમાં હાજરી આપી રહ્યાં છે તેવા સદસ્યો, કે જેમણે ઠરાવો પર રીમોટ ઈ-વોર્ટીંગથી મત આપ્યો નથી, તેઓ એજીએમમાં ઈ-વોર્ટીંગ સિસ્ટમથી મત આપી શકશે.
 - એવા સદસ્યો જેમણે એજીએમ પઠેલા રીમોટ ઈ-વોર્ટીગથી મત આપ્યો છે તેઓ એજીએમમાં ભાગ લઈ શકશે પરંતુ ફરીથી મતદાન નહીં કરી શકે
- (5) કટ ઓફ ડેટના રોજ જેમનું નામ ડિપોઝીટરી દ્વારા જાળવવામાં આવતાં મેમ્બર્સના રજીસ્ટર અથવા બેનીફિશ્ચલ ઓનર્સના રજીસ્ટરમાં નોંધારેલુ છે, માત્ર એવા સદસ્યો જ એજીએમમાં રીમોટ ઈ-વોર્ટીંગ અથવા ઈ-વોર્ટીંગની સવિધા મેળવવા પાત્ર ગણાશે.
- viii. એજીએમની નોટીસમાં એવા સદસ્યો કે જેવો ડીમેટ મોડ, ભૌતિક મોડમાં શેર ધરાવે છે અને એવા સદસ્યો જેમણે પોતાના ઈમેઈલ સરનામાની નોંધ કરાવી નથી તેઓ કેવી રીતે રીમોટ ઈ-વોર્ટીંગ કરી શકે તે દર્શાવવામાં આવ્યુ છે.
- x. જે સદસ્યો ડીમેટરાઈઝ્ડ મોડમાં શેર ઘરાવે છે, અને જેમને પોતાના ઈ-મેલ સરનામાની નોંધણી કરાવી નથી અથવા જેને અઘતન કરાવ્યા નથી તેમને, તેઓ જે ડિપોજીટરી પાર્ટીસીપન્સના માધ્યમથી તેમના ડિમેટ ખાતાનું સંચાલન કરે છે તેમના માધ્યમથી તેમના ઇમેઈલ સરનામા અને મોબાઈલ નંબરોની નોંધણી/અધતન કરાવી લેવા જણાવવામાં આવે છે. ભૌતિક મોડમાં શેર ઘરાવતા સભ્યો, જેમણે કંપનીમાં તેમના ઈમેઈલ સરનામાં નોંધાયેલા અઘતન કર્યા નથી, તેમને કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ મેસર્સ ศโร ย์ครายให ย์คริสา นาย์นิ่ว ติเพิวิร์ หายิ ค้าย์ยู่ไ / અยุดุศ ระนา vadodara@linkintime.co.in. પર વિનંતી કરવામાં આવે છે.

યેકલ્પિક રીતે, સભ્યો નીચે જણાવેલી લીંક પર તેમનું ઈ-મેઈલ સરનામું, મોબાઈલ નંબર, પાન અને બેંક વિગતો અઘતન કરી શકે છે https://www.linkintime.co.in/EmailReg/Email_Register.html

- જે સદસ્યોને એજીએમ તેમજ સીડીએસએલની ઈ-વોર્ટીંગ સિસ્ટમ અંગે કોઈ મુંઝવણ કે મુશ્કેલી હોય, તેઓ helpdesk.evoting@cdslindia.com ને ઈમેઈલ પાઠવીને અથવા ફોન નં. ૦૨૨-૨૩૦૫૮૭૩૮/૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩ પર સંપર્ક કરીને સમાધાન મેળવી શકે છે.
- ૪. બુક કલોઝર :
- કંપનીના રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક્સ શુક્રવાર, તા.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૧થી ગુરૂવાર તા. ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૧ (બન્ને દિવસો સદિત) સુધી નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ની વાર્ષિક સાધારણ સભાને અનુલક્ષીને બંધ રાખવામાં આવશે.

| સ્થળ : વકોદરા. | હોલટાઈમ ડાયરેક્ટર અને કંપની સેકેટરી |
|--------------------|--|
| તારીખ : ૦૩.૦૯.૨૦૨૧ | દિપક રાવલ |
| | બાડ આફ ડાયરકટસના આદશવા ઓપ્ટીમસ ફાઈનાન્સ લિમિટેડ વતી |

GFL લિમીટેક માટે

सही/-ભાવિ શાહ (કંપની સેક્રેટરી)

<u>secretarial@inoxmovies.con</u> ફોન : +૯૧- ૧૧૨૩૩૫૪૭૯૫

Email: bhavi.shah@inoxmovies.com સરનામું : સર્વે નં. ૧૬/૩, ૨૬-૨૭, ગામ રણજીતનગર, તા. ઘીઘમ્બા, જીક્ષા : પંચમહાલ, ગુજરાત - ૩૮૯૩૮૦